

RAN-2508000605020011**T.Y.B.Com. (NCF-NEP) (Sem.-V) Examination March - 2026****Banking Paper - VI (Paper-I)****[Total Marks: 50****સૂચના : / Instructions**

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

Student's Signature

- પ્ર.1. ટૂંકા પ્રશ્નો (કોઈ પણ પાંચ) 10**
1. મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપો.
 2. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની સ્થાપના કોના દ્વારા અને કેટલી મૂડીથી કરવામાં આવી હતી?
 3. બાયોમેટ્રિક્સ શું છે?
 4. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર કોણ છે?
 5. નાણાંકીય સેવાનો અર્થ આપો.
 6. નિયો બેન્કના મુખ્ય લક્ષણો જણાવો.
 7. વિદેશી વિનિમયદરના ફેરફારની લેણદેણની તુલા ઉપર શું અસર થાય?
- પ્ર.2. IRIS Recognition System ના મુખ્ય ઘટકો ની વિસ્તૃત માહિતી આપો. 14**
- અથવા**
- અ. આર્થિક વિકાસમાં કેન્દ્રીય બેન્કનો ફાળો સમજાવો. 07
 - બ. UK ની સેન્ટ્રલ બેન્કના કાર્યો સમજાવો. 07
- પ્ર.3. ફોરેક્સ માર્કેટમાં ચલણ વિનિમયદરોની લાક્ષણિકતાઓ અને ગતિશીલતા વિગતવાર સમજાવો. 14**
- અથવા**
- અ. “નિયો બેન્ક અને પરંપરાગત બેન્ક એક બીજાથી ભિન્ન છે.” આ વિધાન સમજાવો. 07
 - બ. ગ્રીન બેન્કિંગના ઉત્પાદનો વિગતવાર સમજાવો. 07
- પ્ર.4. ટૂંક નોંધ લખો. (કોઈ પણ ત્રણ) 12**
1. મધ્યસ્થ બેંક અને આર્થિક સ્થિરતા
 2. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું સંચાલન
 3. IRIS Recognition System ના ફાયદાઓ જણાવો.
 4. ભારતમાં વિદેશી વિનિમયદરો નો ઇતિહાસ
 5. ગ્રીન બેન્કિંગના લાભ

ENGLISH VERSION

- Q.1. Short Questions (Any Five) 10**
1. Define a Central Bank.
 2. Who established the Bank of England and with how much capital?
 3. What is Biometrics?
 4. Who is the Governor of the Reserve Bank of India?
 5. Define Financial Services.
 6. Mention the key features of a Neo Bank.
 7. What is the effect of changes in foreign exchange rate on the balance of payments?
- Q.2. Explain the main components of the IRIS Recognition System in detail. 14**
- OR**
- Q.2. a. Explain the contribution of the Central Bank in economic development. 07**
b. Explain the functions of the Central Bank of the UK. 07
- Q.3. Explain in detail the characteristics and dynamics of currency exchange rates in the Forex Market. 14**
- OR**
- Q.3. a. "Neo Banks and Traditional Banks are different from each other." Explain this statement. 07**
b. Explain in detail the products of Green Banking. 07
- Q.4. Write short notes. (Any Three) 12**
1. Central Bank and Economic Stability
 2. Management of R.B.I
 3. Advantages of the IRIS Recognition System.
 4. History of Foreign Exchange Rates in India
 5. Benefits of Green Banking
-